

**ઇમાં (અ.સ.)ની
ગયબતમાં ઇમાં
(અ.સ.)થી
નાદીકીના
રસ્તાઓ**

મઅરેફત-મોહુભત-જિદ્ધત

કિતાબનું નામ : ઈમામ (અ.સ.)ની ગયબતમાં ઈમામ
 (અ.સ.)થી નજીદીકીના રસ્તાઓ
 પ્રકાશનનું વર્ષ : શાબાન, હી.સ. ૧૪૩૭, ઈ.સ. ૨૦૧૬
 પ્રકાશક : એસોસીએશન ઓફ ઈમામ મહીદી (અ.સ.)
 પો. બોક્સ નં. ૧૮૮૨૨
 મુખ્ય - ૪૦૦ ૦૫૦

અનુક્રમણિકા

વિષય	પાના
ઈમામ (અ.સ.)ની ગયબતમાં ઈમામ (અ.સ.)થી નજીદીકીના રસ્તાઓ	૩
મઅરેફત-મોહૃષબત-ખિદમત	૩
ઈમામે ઝમાના (અ.સ.)ની ખુલ્લીઓ અને ખાસીયતોની મઅરેફત	૧૪
ઈમામ (અ.સ.)ની મોહૃષબત	૧૮
એક બીજુ રિવાયત	૨૬
ઈમામ (અ.સ.)ની ખિદમત	૩૧
૧) અલ્લાહની આયતોની તિલાવત	૩૪
૨) રૂહાની અને ચારિત્યની તઅલીમ	૩૬
૩) ઈલમ અને છિકમતની તઅલીમ	૪૦
૪) એહુલેબેત (અ.મુ.સ.)ની વિલાયતની તખ્લીગ	૪૩

صَلَّى اللَّهُ عَلَيْكَ يَا وَلِيَ الْعَصْرِ أَدْرِكْنَا
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

ઈમામ (અ.સ.)ની ગયબતમાં ઈમામ (અ.સ.)થી નજીદીકીના રસ્તાઓ

મઅરેફત-મોહુભત-જિદમત

ખુદાવંદે આલમે ઈન્સાનોને ઈબાદત માટે પૈદા કર્યા છે અને ઈબાદતનો મકસદ અલ્લાહુ તાદ્વાની નજીદીકી પ્રાપ્ત કરવી છે. તે ઈબાદત કે જેનો મકસદ અલ્લાહુની નજીદીકી પ્રાપ્ત કરવી ન હોય તેને રિયાકારી અને શીર્ક કહેવામાં આવે છે. ઈબાદત માટે માઝરફેત જરૂરી છે. હુઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ પોતાના સહાબી જનાબે અખુ હુમ્માને ફરમાવ્યું:

‘ચોક્કાસ! ખુદાવંદે આલમની ઈબાદત ફક્ત તે જ કરે છે જે તેની મઅરેફત ધરાવે છે. અગર કોઈ ખુદાની માઝરફેત વગર ઈબાદત કરે છે તો તેની ઈબાદત હૈરાની અને ગુમરાહી સિવાય બીજું કંઈ નથી.’

અરજ કરીઃ હું તમારા ઉપર કુરબાન થાવ! ખુદાની ઈબાદત શું છે? ફરમાવ્યું:

‘ખુદાની તસ્દીક કરવી, તેના રસૂલ (સ. અ. વ.)ની તસ્દીક કરવી, અલી (અ.સ.)ની વિલાયત અને ઈમામતને કબુલ કરવી, હિદાયતના ઈમામો (અ. મુ. સ.)ની ઈમામતને તસ્લીમ કરવી અને તેમના ફશમનોથી બરાઅત કરવી. આ રીતે ખુદાની મઅરેફત પ્રાપ્ત થઈ શકે છે.

(કાફી, ભાગ-૧, પાના નં. ૧૮૦, દ. ૧)

અસંખ્ય રાવીઓએ હજરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) અથવા હજરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી આ રિવાયતની નોંધ કરી છે કે જેમાં ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

‘બંદો ત્યાં સુધી મોઅમ્મીન નથી થઈ શકતો જ્યાં સુધી ખુદાની, તેના રસૂલની, તમામ ઈમામોની અને પોતાના ઝમાનાના ઈમામની મઅરેફત ન ધરાવતો હોય. તમામ અધ્રોમાં તેમની તરફ રજુ થાય અને તેમની સામે સંપૂર્ણ રીતે સમર્પિત રહે. તેને કેવી રીતે છેલ્લા ઈમામની મઅરેફત પ્રાપ્ત થઈ શકે જ્યારે કે તેને પહેલાની જ મઅરેફત પ્રાપ્ત નથી થઈ.’

(કાફી, ભાગ-૧, પાના નં. ૧૮૦, દ. ૨)

એટલે કે ફક્ત એક ઈમામ અથવા અમુક ઈમામોની મઅરેફત પુરતી નથી, બલ્કે તમામ બાર ઈમામોની મઅરેફત જરૂરી અને આવશ્યક છે.

જનાબ મોહમ્મદ બિન મુસ્લીમે હજરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)થી આ રિવાયતની નોંધ કરી છે:

‘જે શાખસ ખુદાવંદે આલમ તરફથી નિયુક્ત ઈમામની મઅરેફત વગર અદ્દાઉનો દીન ઈખ્તેયાર કરે છે અને ઈબાદતમાં ખુબ જ વધારે કોશિશ કરે છે તેનો કોઈ અમલ ખુદાની બારગાહમાં કંબુલ નાહિ થાય. તે ગુમરાહ અને હૈરાન છે. ખુદાવંદે આલમ તેના આમાલને નાપસંદ કરે છે...’

(કાફી, ભાગ-૧, પાના નં. ૧૮૩, દ. ૮)

આ સંદર્ભની ઘણી બધી રિવાયતો ભરોસાપાત્ર કિતાબોમાં મૌજુદ છે. અગાર ઈન્સાન ખુદાવંદે આલમની બારગાહમાં નજીદીકી પ્રાપ્ત કરવા ચાહતો હોય તો તેના માટે ઈબાદત જરૂરી છે, ઈબાદત માટે મઅરેફત જરૂરી છે અને મઅરેફત ઈમામે અસ્ર (અ.સ.)ની મઅરેફત વગર સંપૂર્ણ થઈ શકતી નથી. ઈબાદત ફક્ત અમુક આમાલનું નામ નથી. બલ્કે લિંદગીનું દરેક કાર્ય જે ખુદાવંદે આલમની મરજી મુજબ અંજામ આપવામાં આવે તે ઈબાદત છે અને ઈબાદત માટે મઅરેફત જરૂરી છે અને મઅરેફત ઈમામે ઝમાના (અ.સ.)ની મઅરેફત વગર સંપૂર્ણ નથી. આ આધારે લિંદગીની દરેક પળે અને દરેક ડગલે ઈમામ (અ.સ.)ની મઅરેફત જરૂરી છે.

ઈમામે ઝમાના (અ.સ.)થી નજીદીકી પ્રાપ્ત કરવા માટે ઈમામ (અ.સ.)ની મઅરેફત જરૂરી છે. એ પણ જાણવું જરૂરી છે કે ઈમામ (અ.સ.)માં કઈ કઈ ખુબીઓ જોવા મળે છે. તેમની ખાસીયતો શું છે અને તેમના ઝુહુરની નિશાનીઓ કઈ કઈ છે?

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ખુદાવંદે આલમે જેમને ઈમામ નિયુક્ત કર્યા છે, તેમની સંપૂર્ણ ઈતાઅત કોઈ પણ પ્રકારની શરત વગર જરૂરી અને આવશ્યક છે. અગાર ઈમામની કાયદેસરની મઅરેફત નહિ હોય તો શક્ય છે કે ઈન્સાન તેની ઈતાઅત કરવા લાગે કે જેને અલ્લાહે નિયુક્ત નથી કર્યા. ઈમામતનો હોદ્દો અગ્રીમ છે. તેના દાવેદાર ઘણા છે. આથી સાચા અને હુક્ક ઈમામની મઅરેફત જરૂરી છે. આ સમયે હુજરત હુજજત ઈબ્નિલ હુસન અલ અસ્કરી (અ.સ.) ઝમાનાના ઈમામ છે. તેમની સંપૂર્ણ ઈતાઅત આપણા ઉપર વાજુબ છે. આથી તેમની મઅરેફત પ્રાપ્ત કરવી પણ વાજુબ છે. અગાર કોઈને અત્યારે પોતાના ઝમાનાના ઈમામ હુજરત

મહદી (અ.સ.)ની મઅરેકત નથી તો તેની મૌત ઈમાન ઉપર નહિ થાય, બલ્કે તેનું મૌત જાહેલીયત અને કુફનું હશે.

મૌલાએ કાયેનાત ઈમામ અલી ઈખે અભી તાલિબ (અ.સ.) એ કુફાના મિશ્બર ઉપરથી એક ખુત્બા દરમ્યાન ઈરશાદ ફરમાવ્યું:

‘ખુદાયા! તારી જમીન ઉપર તારી મળુકતા માટે તારી એક હુજુજતનું હોવું જરૂરી છે કે જે લોકોને તારા દીન તરફ હિદાયત કરે, તારા ઈલમોથી માહિતગાર કરે કે જેથી તારી દલીલો બાતિલ ન થાય અને તારા વલીઓનું અનુસરણ કરનારાઓ હિદાયત પામ્યા પછી ગુમરાહ ન થાય. ચાહે તો આ હુજુજત જાહેર હોય કે લોકો તેમનું કહેવું માની રહ્યા હોય અથવા તો તે છુપાએલી અને ગાએબ હોય. અગરચે લોકોના અમ્નના ઝમાનામાં આ હુજુજત લોકોની નજરોથી ગાએબ હશે પરંતુ તેમનું ઈલમ છુપાએલું નહિ હોય. મોઅમીનોના દિલોમાં તેમના આદાબ સ્પષ્ટ અને સ્થાપિત હશે અને તેઓ તેના ઉપર અમલ કરી રહ્યા હશે.’

(કમાલુદીન, ભાગ-૧, પાના નં. ૩૦૨)

આ વાક્યો ધ્યાન આપવા લાયક છે.

‘મોઅમીનોના દિલોમાં તેમના આદાબ સ્પષ્ટ અને સ્થાપિત હશે.’

આદાબ એટલે કે તેમની આદતો, તેમની ખુબીઓ, તેમના કમાલાત અને તેમની ખાસીયતો, વિગેરે... આ બધું મોઅમીનોના દિલોમાં સુરક્ષિત છે. તેઓ તેમના આદાબ ઉપર અમલ કરે છે

એટલે કે તેમની તાત્કાલિકમાત ઉપર અમલ કરે છે, તેમના રસ્તા ઉપર ચાલે છે, તેમની ખુબીઓ અને ખાસીયતોને અપનાવે છે.

ઈમામે જમાના (અ.સ.)થી સંબંધીત તેમની ખાસીયતોને જાગુવી અત્યંત જરૂરી છે. કારણ કે દરેક સમય અને જમાનામાં ઈમામત અને રેહબરના દાવેદાર ઘણા લોકો રહ્યા છે. તે પરિસ્થિતિમાં જ્યાં સુધી મોઅમ્ભીન પોતાના જમાનાના ઈમામની ખાસીયતોથી માહિતગાર નહિ હોય અને તેમની મઅરેફત નહિ ધરાવતો હોય તો કેવી રીતે તે દક્ક અને બાતિલને ઓળખી શકશે અને તે કેવી રીતે સાચા અને ખોટામાં તફાવત કરી શકશે.

આપણા સમાજમાં ઈમામે જમાનાનું વર્ગન ત્યારે કરવામાં આવે છે જ્યારે આપણે બાર ઈમામોના નામ ગણી રહ્યા હોઈએ અને અંતમાં આખેરુઝીજમાન ઈમામ મહિદી (અ.સ.) કહીને આદત અનુસાર માથુ જુકાવી દઈએ છીએ તે પણ આદતના કારણે અથવા તો ૧૫ મી શાબાનના મૌકા ઉપર હુલવા ઉપર નજર અપાવતા સમયે. તેનું કારણ એ છે કે આપણને જમાનાના ઈમામની મઅરેફત નથી. મઅરેફત નથી આ આધારે તેમનાથી નજદીકી અને દૂરીનો એહસાસ પણ નથી. આપણને ખરેખર એ નથી ખબર કે આપણી જિંદગીમાં, આપણી ઈબાદતોમાં, બલાઓથી સુરક્ષિત રહેવામાં, રિઝક અને જિંદગી... વિગેરેમાં ઈમામ (અ.સ.)નું શું મહત્ત્વ છે અને તેમના સંદર્ભમાં આપણને શું શું મળી રહ્યું છે. ઈરાનના ઈન્કેલાબની પહેલા લોકોના ઘરો અને આલીમોમાં દોઆએ અલલાહુમ કુન્લે વલીયેક... નો કોઈ રિવાજ જોવા મળતો ન હતો. ઈરાનના ઈન્કેલાબ પછી આ જિંક ઈન્ડુસ્ટ્રાનમાં ફેલાયો અને

અત્યારે બાળકોની જબાન ઉપર પણ આ દોઆ જોવા મળે છે. કુનુતમાં, નમાઝોની પછી તખીબાતમાં આ દોઆનું ચલાણ સામાન્ય થઈ રહ્યું છે. પરિસ્થિતિ પહેલાની સરખામણીએ ઘણી બહેતર છે. પરંતુ હજુ પણ ઘણું બધું બાકી છે.

કુઝૈલ બિન યસારે હજરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.)ને કુરઆને કરીમની આ આયતના બારામાં પુછ્યું:

يَوْمَ نَدْعُوكُلَّ أُنَيْسٍ يَأْمَأِهِمْ

“જે દિવસે અમે તમામ લોકોને તેઓના ઈમામની સાથે બોલાવીશું.”

(સુરએ બની ઈસરાઈલ-૧૭, આયત નં. ૭૧)

હજરત સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) એ ઈરશાદ ફરમાવ્યું:

‘આય કુઝૈલ! તમારા ઈમામની મઅરેફત પ્રાપ્ત કરો. અગર તમને તમારા ઈમામની મઅરેફત હશે તો જુહુરનું વહેલું અથવા મોડું થવું તમારા માટે નુકશાનદાયક નહિ હોય.

જે શાખસ જમાનાના ઈમામની મઅરેફત ધરાવતો હોય અને સાહેબે અશ્ર (અ.સ.)ના જુહુર પહેલા આ કુનિયાથી ચાલ્યો જાય તો તેને તે લોકોનો દરજાઓ મળશે કે જેઓ તેમની સાથે તેમના લશકરમાં હશે. બલ્કે તે લોકોનો દરજાઓ મળશે કે જેઓ તેમની સાથે તેમના પરચમ હેઠળ હશે.’

આને અમુક સહાવીઓને આમ પણ ફરમાવ્યું:

‘તેને દુર્ગરત રસૂલે અકરમ (સ.અ.વ.)ની સાથે રહીને શહુદત પામવાનો દરજો મળશે.’

(કાફી, ભાગ-૧, પાના નં. ૩૭૧, હ. ૨)

ઉપરોક્ત હુદ્દીસ ઉપર ધ્યાન આપવાથી અમુક બાબતો સામે આવે છે.

- ૧) પોતાના જમાનાના ઈમામની મઅરેફત જરૂરી છે.
- ૨) અગર જમાનાના ઈમામની મઅરેફત હશે તો પછી ઈમામ (અ.સ.)ના ઝુહુરમાં જદ્દી અથવા મોહુ થવું ઈન્સાનના અકીદાને અસરઅંદાજ નહિ કરે.
- ૩) અગર જમાનાના ઈમામની મઅરેફત હશે અને ઝુહુર પહેલા મૌત આવી જાય એટલે કે જિંદગીમાં ઈમામ (અ.સ.)ના દિદાર નસીબ ન થાય તો પણ ઈમામ (અ.સ.)થી નજીદીકીનો દરજો હશે.
- ૪) મઅરેફતના આધારે ઈમામે જમાના (અ.સ.)થી એટલી હુદે નજીદીકીનો દરજો મળશે જાણે કે તેમની સાથે તેમના લશકરમાં હોય એટલે કે તેમના સમુહમાં. આ અલલાહનું તે લશકર છે જેના માટે કોઈ ગમ કે દર્દ નહિ હોય.
- ૫) જેટલી હુદે મઅરેફત સંપૂર્ણ અને વધારે હશે તેટલી જ નજીદીકી પણ વધારે હશે. એક દરજો ઈમામ (અ.સ.)ના લશકરમાં શામેલ થવા સુધીનો છે, એક દરજો ઈમામના પરચયમ હેઠળ ઈમામની સાથે રહેવાનો છે અને એક દરજો શહુદત ઉપર ફાયેજ થવાનો છે.

૬) આ ઈમામ (અ.સ.)ની મઅરેફત છે કે જે શહુદત પામ્યા
વગર રસુલે ખુદા (સ.અ.વ.)ની સાથે શહુદતનો દરજો
અતા કરે છે.

આ એક હકીકત છે કે આ સમયે આપણા જમાનાના ઈમામ
હિન્દુરત હુજુજત ઈભિન્લ હસન અલ અસ્કરી (અ.સ.) ખુદાના
હુકમથી ગયબતના પર્દામાં છે. આ સમયે તેમનાથી મુલાકાત અને
નજીદીકી દરેક માટે શક્ય નથી. ઈમામે જમાના (અ.સ.)થી દૂરી
હુલાકતનું કારણ છે. આથી નજીદીકી પ્રાપ્ત કરવી જરૂરી છે. આ
સમયે ઈમામ (અ.સ.)થી નજીદીકી પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો
તેમની મઅરેફત છે. અગર ઈમામે જમાના (અ.સ.)ની મઅરેફત છે
તો પછી ઈમામ (અ.સ.) દૂર હોવા છતાં આપણે તેમનાથી નજીદીક
છીએ અને અગર મઅરેફત નથી તો નજીદીક હોવા છતાં પણ દૂર
છીએ. જે લોકોના દિલ ઈમામે જમાના (અ.સ.)ની મઅરેફતથી
મુનાવર છે તે પોતાના તમામ આમાલ ઉપર ઈમામ (અ.સ.)ને
હાયીર અને નાયીર જાણો છે.

દોઆએ નુદબા ઈમામે જમાના (અ.સ.)ની મઅરેફતનો સૌથી
શ્રેષ્ઠ જરીયો અને ખજાનો છે. પરંતુ શરત એ છે કે તેને સમજુ
સમજુને પઢવામાં આવે અને તેના અર્થો ઉપર ચિંતન-મનન
કરવામાં આવે. ઈમામ (અ.સ.)ની નજીદીકીનો અહેસાસ આ
દોઆમાં આ રીતે બયાન કરવામાં આવ્યો છે.

بِنَفْسِي أَنْتَ مِنْ مُّغَيْبٍ لَمْ يَجِدْ مِنَّا

بِنَفْسِي أَنْتَ مِنْ نَازِحٍ مَا نَرَحْ عَنَّا

‘મારી જાન તમારા ઉપર કુરબાન થાય! તમે તે ગાએબ
છો કે જેમની જગ્યા ખાલી નથી.

મારી જાન તમારા ઉપર કુરબાન થાય! તમે તે દૂર છો કે
જે અમારાથી કયારેય દૂર નથી.’

બહુકે એક વાક્યમાં તો એમ પણ આવ્યું છે કે તમે અમારાથી
એટલી હુદે નગદીક છો કે જ્યારે પણ કોઈ મોઅમીન અથવા કોઈ
મોઅમેના આપનો લિક કરે છે તો તે રૂદ્ધન કરવા લાગે છે.

ઈમામે જમાના (અ.સ.)ની મઅરેફત અલલાહની નગદીકી,
આમાલાની કબુલીયત અને નજીત તથા સઆદતનું માધ્યમ છે.
આથી આનાથી વધારે મહુત્ત્વની પૂંજી બીજી કંઈ નથી અને આ
પૂંજીથી ફાયદામંદ બીજો કોઈ ખરાનો પણ નથી.

સવાલ એ છે કે મઅરેફત એટલે શું? અને આ મઅરેફત કેવી
રીતે પ્રાપ્ત કરી શકાય?

ઈમામે જમાના (અ.સ.)ની મઅરેફતના બે રસ્તાઓ છે.

૧) ઈમામે જમાના (અ.સ.)ના નામ અને વંશવેલાની
મઅરેફત.

૨) ઈમામે જમાના (અ.સ.)ની ખુબીઓ અને ખાસીયતોની
મઅરેફત.

બન્નો મઅરેકઠો જરૂરી છે. એક પરિસ્થિતિ એમ છે કે અત્યારે એક ઈમામ મૌજુદ છે કે જે તે ખુબીઓ અને ખાસીયતો ધરાવે છે અને બીજી પરિસ્થિતિ એમ છે કે તે શાખ્સીયતા કે જે તમામ ખુબીઓ, જમાલ અને કમાલોનો મજબુઓ છે, તે હુઝરત હુજજત ઈભિન્નલ હુસન અલ અસ્કરી (અ.સ.) છે અને તેમના સિવાય બીજું કોઈ નથી.

અમુક રિવાયતોમાં તે શાખસની મૌતને જાહેલીયતની મૌત કરાર દેવામાં આવી છે કે જે એહુલેબૈત (અ.મુ.સ.)ને દોસ્ત રાખતો હોય, તેમના દુઃમનોથી બરાઅત કરતો હોય, તેમણે હલાલ કરેલી વસ્તુઓને હલાલ અને હુરામ કરેલી વસ્તુઓને હુરામ જાણતો હોય અને એમ પણ અકીદો ધરાવતો હોય કે ઈમામત એહુલેબૈત (અ.મુ.સ.)માં છે પરંતુ એમ વિચારતો હોય કે તે લોકોમાં આપસમાં વિરોધાભાસ છે. આ હુઝરાત જ્યારે કોઈ એકની ઈમામત ઉપર એકમત થઈ જાય અને તેમને ઈમામ માની દેશો. ઈમામ (અ.સ.) ફરમાવે છે:

‘તેમની મૌત જાહેલીયતની મૌત હશે.’

(ગયબતે નોઅમાની, પાના નં. ૬૫)

ઈમામત એ ઈલાહી હોદ્ડો છે. તેમાં લોકો દ્વારા ચુંટવાની કે નહિ ચુંટવાની કોઈ દખલ નથી. એવું હરગીજ નથી કે એક ઈમામના જવા પછી એહુલેબૈત (અ.મુ.સ.)ના ખાનદાનના લોકો મળીને કોઈ વ્યકિતને ઈમામ નિયુક્ત કરતા હોય અને લોકો તેમની નિયુક્તીનો ઈન્તેજાર કરતા હોય. બલ્કે ખુદા ઈમામની નિયુક્તિ કરે છે. આ આધારે ઈમામ (અ.સ.)ની મઅરેકતના સિલસિલામાં ઈમામનું નામ

અને વંશ જાગવો ખુબ જ જરૂરી છે. હાલાકે ફક્ત તે જાગવું મઅરેફત માટે પુરતું નથી અને ન ફક્ત આટલું જાગવાથી જહેલીયતાની મૌતથી નજીત મળી શકે છે. કારણ કે જે લોકોએ એઈમા (અ.મુ.સ.) ઉપર જુલ્મો સિતમ ગુજર્યા, તેઓને કત્લ કર્યા, તેઓને શાહીદ કર્યા, તેઓ ઈમામના નામ અને વંશથી સારી પેઠે માહિતગાર હતા. બહુરહાલ નામ અને વંશ જાગવો મઅરેફતનો સૌથી નીચલો અને પહેલો દરજણો છે. આપણે પોતે પણ આપણા બાળકોને એટલું જરૂર જાણવવું જોઈએ કે આપણા ઝમાનાના ઈમામ (અ.સ.)નો વંશ આ મુજબ છે.

નામ : મીમ-હે-મીમ-દાલ

લક્ષ્ય : મહંદી, ઈમામે ઝમાના, વલીએ અસ્ર,
કાએમ (અ.સ.), સાહેબગુજમાન વિગેરે...

પિતાનું નામ: હુઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.)

માતાનું નામ: જનાબે નરજિસ ખાતુન (સ.અ.) કે જેમને
સોસન પણ કહેવામાં આવે છે.

વિલાદતની તારીખ: ૧૫ મી શાબાન, હી.સ. ૨૫૫, શુક્રવાર

વિલાદતનું સ્થળ: સામર્દ્દ, ઈરાક

ખુદાના ફળો કરમથી હજુ સુધી ઈમામ (અ.સ.) જીવંત છે, યુવાન છે, ખુદાના હુકમથી અત્યારે એવી રીતે લિંદગી પસાર કરી રહ્યા છે કે તેઓ તો આપણને જોઈ રહ્યા છે પરંતુ આપણે તેઓને ઓળખી નથી શકતા. જ્યારે ખુદા હુકમ કરશે ત્યારે તેઓ જહેર થશે, બધા લોકો તેમને જોશો અને ઓળખશે.

ઇમામે ઝમાના (અ.સ.)ની ખુબીઓ અને ખાસીયતોની મઅરેફતઃ

અત્યારે ઇમામે ઝમાના (અ.સ.) ગયબતમાં છે. આ આધારે આપણે તેમની ઝાતને ઓળખી શકતા નથી. આથી કોઈના પણ બારામાં એમ નથી કહી શકતા કે ‘આ ઇમામ છે’. ઇતિહાસમાં એવા લોકો જોવા મળે છે કે જેઓએ તકનો ગેરલાભ લઈને પોતાને ઇમામ તરીકે જાહેર કર્યા છે. આ આધારે આજના ઝમાનામાં ઇમામની નિશાનીઓ, ખુબીઓ અને ખાસીયતોને જાણવી અત્યંત જરૂરી છે કે જેથી કરીને આપણે ઇમામે હુક્કને ઓળખી શકીએ અને જુદ્ધા દાવેદારોના પ્રપંચમાં ન સપડાઈએ. હજરત ઇમામ જઅફ્રે સાદિક (અ.સ.)એ પોતાના બુગ્રૂ સહાબી જનાબે ઉમરુ બિન અબાનને ફરમાવ્યું:

‘નિશાનીઓને ઓળખો.’

(કાફી, ભાગ-૧, પાના નં. ૩૭૨, હ. ૭)

નિશાની તેને કહેવામાં આવે છે કે જેનાથી વસ્તુને કાયદેસર રીતે ઓળખી શકાય અને તેને ઓળખવામાં કોઈ ભુલ ન થાય.

હજરત ઇમામ જઅફ્રે સાદિક (અ.સ.) એ ખુદા, રસુલ અને ઇમામની મઅરેફતના સિલસિલામાં આ રીતે બયાન ફરમાવ્યું છે. ઇમામ (અ.સ.) એ પોતાના સહાબી જનાબે મોઆવીયા બિન વહેબને ફરમાવ્યું:

‘સૌથી વધારે ફરીલત ધરાવનાર અને વાળબ
જવાબદારી ખુદાની મઅરેફત પ્રાપ્ત કરવી છે, તેના બંદા
હોવાનો અને તેની બંદગીનો ઈકરાર કરવો. મઅરેફતની હંદ

એ છે કે એ જાગતો હોય કે અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી અને તેના જેવું બીજું કોઈ નથી. એ પણ જાગતો હોય કે તે પદેલાથી છે અને સાબિત છે, મૌજુદ છે અને ગાએબ નથી. તેની સિફતો છે પરંતુ તેની સિફતો બીજોની જેવી નથી. તેના જેવું બીજું કોઈ નથી. તે હક્ક છે અને બાતિલ નથી. તેના જેવું પણ કોઈ નથી. તે તમામ બાબતોનો સાંભળનાર અને દરેક વસ્તુઓનો જોનાર છે.

તેના પછી રસુલ (સ.અ.વ.)ની મઅરેફત છે, તેમની નુભુર્વતની ગવાહી આપવી. રસુલ (સ.અ.વ.)ની ઓછામાં ઓછી મઅરેફત એ છે કે તેમની નુભુર્વતનો એકરાર કરવો, તેઓ જે કંઈ લાવ્યા છે કિતાબ, હુકમ, મનાઈ તે બધુંજ અલ્લાહ તરફથી છે.

તેના પછી ઈમામની મઅરેફત, તેમની ખુબીઓ, ખાસીયતો અને તેમના નામથી તેઓની ઈમામત કબુલ કરવામાં આવે અને આસાની અને મુશ્કેલીઓમાં તેની ઉપર સાબિત કદમ રહેવું છે.

ઈમામની ઓછામાં ઓછી મઅરેફત એ છે કે તેઓ નુભુર્વત સિવાય તમામ ખુબીઓ અને ખાસીયતોમાં નબી જેવા છે. તેમના વારીસ છે, તેમની ઈતાયત ખુદા અને રસુલની ઈતાયત છે. દરેક બાબતોમાં તેમને સમર્પિત થવું અને દરેક બાબતોમાં તેમના તરફ રજુ થવું અને તેમની વાતો ઉપર અમલ કરવો છે અને એ જાગી લો કે હજરત રસુલે ખુદા (સ.અ.વ.) પછી ઈમામ અલી ઈન્ને અબી

તાલિવ (અ.સ.), તેમના પછી હસન (અ.સ.), તેમના પછી હુસૈન (અ.સ.), તેમના પછી અલી ઇબને હુસૈન (અ.સ.), તેમના પછી મોહમ્મદ ઇબને અલી (અ.સ.), તેમના પછી જાયફર ઇબને મોહમ્મદ (અ.સ.), તેમના પછી મુસા ઇબને જાયફર (અ.સ.), તેમના પછી અલી ઇબને મુસા (અ.સ.), તેમના પછી મોહમ્મદ ઇબને અલી (અ.સ.), તેમના પછી અલી ઇબને મોહમ્મદ (અ.સ.), તેમના પછી હસન ઇબને અલી (અ.સ.) અને તેમના પછી હસન (અ.સ.)ના ફરજિંડ હુક્મજત (અ.સ.) છે.’

ત્યારબાદ ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

‘અય મોઆવીયા! મેં મુળ બયાન કરી દીધું છે, તેના ઉપર અમલ કરો.’

(તક્ષિક્રિયા બુરહાન, ભાગ-૨, પાના નં. ૨૪, હ. ૩)

ઈમામ (અ.સ.)થી નજીદીકીનો એક રસ્તો તેમનાથી સંબંધીત અદબ અને એહૃતેરામનો ઘ્યાલ રાખવો છે. અગાર તમે કોઈની સાથે પણ અદબ અને એહૃતેરામથી વર્તન કરશો તો તમે તેના દિલમાં તમારા માટે જગ્યા બનાવશો. દિલને દિલથી એક ખાસ સંબંધ હોય છે. એક શાખ્સે ઈમામ (અ.સ.)ને પુછ્યું કે ખુદાની નજરોમાં મારી શું હૈસીચ્યત અને મર્તબો છે. ફરમાવ્યું કે તમારા દિલમાં ખુદાની કેટલી હૈસીચ્યત અને મર્તબો છે. જેટલી હુદે આપણા દિલમાં આપણા જમાનાના ઈમામનો એહૃતેરામ હુશે, તેમનાથી સંબંધીત વસ્તુઓની આપણે જેટલી કદર કરશું, તેમનાથી સંબંધીત કામનું

જેટલું મહત્વ હશે, તેમની બિદમતગુરુરીનો જેટલો હોંસલો હશે
તેટલો જ ઈમામ (અ.સ.)થી નજીદીકીનો એહસાસ હશે.

આદબ અને એહતેરામનો એક રસ્તો લકબની સાથે તેમનો ઝિક
કરવો છે. જેમકે હુજુત, કાયેમ, મહદી, મુન્તજર, સાહેબુલ અખ,
સાહેબુગુરમાન વિગેરે...

એ વાત પણ ધ્યાનમાં રહે કે ઈમામ (અ.સ.)ની ગયબતનું એક
કારણ તેમની જાનની હિફાજત પણ છે. ઈમામત અને ઈમામના
દુશમન કાલે પણ હતા અને આજે પણ મૌજુદ છે. આથી ઈમામ
(અ.સ.)નો ઝિક તે જગ્યાઓએ કરવાથી પરહેજ કરવો જોઈએ
જ્યાં લોકો તેમને કબુલ કરવા માટે તૈયાર ન હોય, બલ્કે તેમનો
ઝિક કરવાથી તેમનાથી વધારે દુશમની માટે ઉત્તરી પે.

એહતેરામનો એક અંદાજ એ પણ છે કે જ્યારે તેમનો લકબ
'કાયેમ' નો ઝિક કરવામાં આવે ત્યારે તેમના એહતેરામમાં ઉભા
થઈ કિબલા રૂખ થઈને માથા ઉપર હાથ રાખવામાં આવે અને
સલવાત વડે આપણા એહતેરામનો ઈજહાર કરવો જોઈએ.
એહતેરામનો આ રસ્તો હુજુત ઈમામ અલી રેઝા (અ.સ.)થી
વારીદ થયો છે.

ઇમામ (અ.સ.)ની મોહબ્બત

અદ્દલાઈ અને તેના રસુલ (સ.અ.વ.)એ એહુલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બત અને મવકતને વાળું કરાર દીધી છે. તેમની મોહબ્બત ઇમાનનો ભાગ છે અને આમાલ કબુલ થવાની બુનિયાદી શરતોમાંથી છે.

ઈન્સાન ત્યારે જ પોતાના દિલમાં કોઈની મોહબ્બતને મેહસુસ કરે છે જ્યારે તેને એ એહુસાસ થાય કે તેની લિંદગીમાં તે શાખ્સના શું શું એહુસાન છે.

ખુદાવંદે આલમે જનાબે દાઉદ (અ.સ.)ને ફરમાવ્યું:

‘અય દાઉદ! તમે મારાથી મોહબ્બત કરો અને લોકોના દિલોમાં પણ મને મેહબુબ બનાવો. અરજ કરી ખુદાયા! હું તો તારાથી મોહબ્બત કરું છું પરંતુ લોકોના દિલોમાં તને કેવી રીતે મેહબુબ બનાવું? ફરમાવ્યું: તેઓની સમક્ષ મારી નેઅમતોનું વર્ણન કરો. જ્યારે મારી નેઅમતોનું વર્ણન કરશો ત્યારે લોકો મારાથી મોહબ્બત કરવા લાગશો.’

(બેહુડુલ અન્વાર, ભાગ-૧૪, પાના નં. ૩૭, હુદીસ નં. ૧૬)

હજરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘ખુદાને તેની નેઅમતોના લીધે મોહબ્બત કરો, ખુદાની ખાતર મારાથી મોહબ્બત કરો અને મારી ખાતીર મારા એહુલેબૈતથી મોહબ્બત કરો.’

આગાર આપણે થોડું પણ ધ્યાન આપીએ તો અત્યારે આપણી પાસે જે કંઈ નેઅમતો છે કે જેને આપણે કોઈ પણ પ્રકારે ગણી નથી

શક્તા. આ બધી નેઅમતો ઈમામે જમાના, હજરત ઈમામ મહુદી, સાહેબુઝુમાન (અ.સ.) થકી આપણને મળી રહી છે. લિંદગી, તંકુરસ્તી, સલામતી, રિજક, આયુષ્ય, ઈમાન, તવફીક... આ બધી તે નેઅમતો છે કે જે આખી દુનિયા મળીને પણ કોઈ એક નેઅમતની પણ કિંમત થઈ શકતી નથી. આ બધી નેઅમતો આપણને ઈમામ (અ.સ.)ના લીધે મળી રહી છે. આ ઉપરાંત તે જ ઈમામે જમાનાના લીધે આપણી સકરાતની મંજીલો આસાન થશે, કબ્રનો અંધકાર દૂર થશે, કબ્રના ફિશારથી નજીત મળશે, બરજખના સખત અગ્રાભથી છૂટકારો મળશે. મયદાને મેહશરમાં તેમના સમુહમાં શામેલ થવાનો શરફ મળશે, તેમની શક્ફાઅત થકી હિસાબ અને કિતાબની મંજીલો આસાન થશે, જન્નતની રાહો હુમવાર થશે અને અગર તેમની મોહુભૂતથી દિલ ખાલી હશે તો પછી આ બધી નેઅમતોનો ઉપયોગ નાશુકી ગણાશે.

હજરત રસુલે ખુદા (સ.અ.વ.) એ એક હૃદીસમાં ઈરશાદ ફરમાવ્યું છે:

لَا يُؤْمِنُ عَبْدٌ حَتَّىٰ أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ نَفْسِهِ
وَ يَكُونَ عِنْرَقٌ أَحَبَّ إِلَيْهِ مِنْ عِنْرَتِهِ وَ يَكُونَ أَهْلًا
أَحَبَّ إِلَيْهِ مِنْ أَهْلِهِ وَ يَكُونَ ذَاتٌ أَحَبَّ إِلَيْهِ مِنْ ذَاتِهِ
કોઈ પણ બંદાનું ઈમાન ત્યાં સુધી સંપૂર્ણ નથી થઈ
શકતું કે જ્યાં સુધી તે મને પોતાને પોતાની જાત કરતા
વધારે ન ચાહતો હોય અને મારી આલને પોતાની આલ
કરતા વધારે પસંદ ન કરતો હોય અને મારા એહલેબેતાને

પોતાના સગાવ્લાલાઓ કરતા વધારે ન ચાહતો હોય અને
મારી જાત તેની નજીક ખુદ પોતાની જાતથી વધારે પ્રિય ન
હોય.'

(મિઝાનુલ હિકમત, ભાગ-૨, પાના નં. ૨૩૬, હ. ૩૧૮૮)

આ એક હકીકત છે કે અત્યારે હિન્ડુરત વલીએ અસર (અ.સ.)ની પવિત્ર જાતથી વધારે કોઈ પણ રસુલે ખુદા (સ.અ.વ.)થી નજીક નથી. તેમના સિવાય કોઈ પણ રસુલે ખુદા (સ.અ.વ.)ના કમાલાત અને સિફ્ફતોનો અરીસો નથી. કોઈ પણ તેમનાથી વધારે રસુલે ખુદા (સ.અ.વ.)થી મળતું આવતું નથી. આ આધારે આયએ મવદત અને તે પ્રકારની બીજી અસંખ્ય રિવાયતોની રોશનીમાં આપણે હિન્ડુરત ઈમામે જમાના (અ.સ.)થી બેહુદ મોહુભૂત કરવી જોઈએ. આ પ્રકારની સંપૂર્ણ મોહુભૂતનો નમુનો આપણને એહુલેબૈત (અ.મુ.સ.)માં અને તેમના સહાબીઓ અને મદદગારોની ઝિંદગીમાં જોવા મળે છે.

ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) હિજરતની રાત્રે હિન્ડુરત રસુલે ખુદા (સ.અ.વ.)ના બિસ્તર ઉપર સુઈ જાય છે કે જેથી રસુલે ખુદા (સ.અ.વ.) સલામત રહે. જનાબે જહરા (સ.અ.) દરવાજા ઉપર આવે છે કે જેથી જમાનાના ઈમામ અલી (અ.સ.) સુરક્ષિત રહે. જંગમાં ઈમામ (અ.સ.) પોતાના પુત્ર જનાબે મોહમ્મદે હનફીયા, વિગેરેને જંગમાં મોકલે છે. હિન્ડુરત ઈમામ હુસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ને જંગમાં નથી મોકલતા અને જ્યારે લોકો કહે છે કે તમે શા માટે હુસન (અ.સ) અને હુસૈન (અ.સ.)ને જંગમાં નથી મોકલતા? તો ફરમાવે છે કે

હુસેન (અ.સ.) અને હુસૈન (અ.સ.) હજરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ફરજંદ છે અને મોહમ્મદે હનકીયા મારા ફરજંદ છે. આને કહેવાય રસુલ (સ.અ.વ.)ની આલને પોતાની આલ કરતા વધારે ચાહુવી.

કરબલાના મૈદાનમાં એહુલેબૈત (અ.મુ.સ.)ના ખાનદાન કરતા પહેલા સહાબીઓએ પોતાની જાનને કુરબાન કરી કારણ કે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ના સગાવ્લાલા અને તેમની આલ હતા અને ખુદ એહુલેબૈત (અ.મુ.સ.)ના ખાનદાનવાળાઓએ પોતાની જાનને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર પહેલા કુરબાન કરી દીધી.

આ કુરબાની અને પોતાની ઉપર અગ્રતા આપવાનો બદલો ખુબ જ અઝીમ છે. ઈમામ અલી ઈબ્ને અભી તાલિબ (અ.સ.)ની શાનમાં આયત નાઝીલ થઈ છે અને ઈમામ હુસૈન (અ.સ.)ના સહાબીઓને ઈમામના હરમમાં જગ્યા મળી છે. હજરત ઈમામ હુસૈન (અ.સ.)ની સાથે સાથે તેમની પણ જિયારત કરવામાં આવે છે. હજરત ઈમામ હુસૈન (અ.સ.)ની જિયારત કરનાર દરેક શાખ્સ આમ કહેતો જોવા મળે છે કે:

‘કાશ! હું પણ તમારી સાથે હોત તો હું પણ આ મહાન સાચાદતને પ્રાપ્ત કરત.’

અગર ઈમામતનો સિલસિલો સચ્યદુરશોહુદા, હજરત ઈમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર જાત ઉપર તમામ થઈ ગયો હોત તો આ આરજુ ફક્ત દોઆના સ્વરૂપે જ બાકી રહી જાત અને તેના ઉપર અમલ કરવાની કોઈ શક્યતા નજર ન આવત. પરંતુ ખુદાના ફરજલો કરમથી અત્યારે પણ ઈમામતનો સિલસિલો પોતાની તમામ શાનો

શૈકૃતની સાથે તમામ ખુબીઓ અને કમાલાતની સાથે હજરત વલીએ અસર (અ.સ.)ના સ્વરૂપે મૌજુદ છે. કરબલામાં હજરત ઈમામ હુસૈન (અ.સ.) જમાનાના ઈમામ હતા અને આ જમાનામાં આખેરુઝઝમાં, ઈમામે વકત હજરત ઈમામ મહિદી (અ.સ.) છે. સચ્યદૃષ્ટશોહદા હજરત ઈમામ હુસૈન (અ.સ.)નો જે મકામ અને મન્જેલત છે તે પોતાની જગ્યાએ છે. તે દરજજાને કોઈ પણ હુંસીલ નથી કરી શકતું. કાલે ઈમામ હુસૈન (અ.સ.) દુશ્મનોમાં ઘેરાય ગયા હતા, તેઓ ઉપર તીર, તલ્વાર, નેઝાઓ વડે હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા અને અત્યારે ઈમામે જમાના (અ.સ.) ઉપર એઅતેરાજાત, શંકાઓ અને કુશંકાઓના હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ઈમામે જમાનાથી મોહુભૂતનો તકાળો એ છે કે જેટલી હુદે આપણે આપણી ઉપર થનારા એઅતેરાજાતથી ગમગીન થઈએ છીએ તેની કરતા વધારે ઈમામ ઉપર થતા એઅતેરાજાત, શંકા અને કુશંકાઓથી નારાજ અને ગમગીન થવું જોઈએ કે જે હજરત વલીએ અસર (અ.સ.)ના અકીદાઓ ઉપર કરવામાં આવી રહ્યા છે. જે રીતે આપણે આપણો બચાવ કરીએ છીએ, તેનાથી વધારે હજરત વલીએ અસર (અ.સ.)નો બચાવ કરીએ. ખુદાવંદે આલમ આપણાથી આ પ્રકરની તીવ્ર મોહુભૂતનો તકાળો કરે છે. તે મોહુભૂત જ નથી કે જેનો કોઈ અમલી અસર ન હોય.

આમ તો એહુલેબેત (અ.મુ.સ.)ની દરેક વ્યક્તિ સંપૂર્ણ છે અને દરેક કમાલાત અને અલ્લાહની નજીદીકીના અનંત દરજજા ઉપર બિરાજમાન છે. પરંતુ રિવાયતોમાં હજરત વલીએ અસર (અ.સ.)ને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

જ્યારે હજરત રસુલે ખુદા (સ.અ.વ.) મેઅરાજ ઉપર તશીક લઈ ગયા. એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે મેઅરાજની રાતે આસ્માન ઉપર બોલાવીને તે મલકૃતી વાતાવરણમાં જે ચર્ચા કરવામાં આવે તેનું એક ખાસ મહત્વ હોય છે. આવા મહત્વના પ્રસંગે અને પવિત્ર જગ્યાએ કોઈ સામાન્ય ચર્ચા ન થાય. જે પણ ચર્ચા થાય તેના મહત્વનો અંદરો લગાવવો તે આપણી જેવા ખતાકાર ઈન્સાનોની હૈસિથ્યતથી બહારની વાત છે. અલભાતા, તેની સામે સમર્પિત થઈ જવું અને તેને કબુલ કરી લેવું ઈમાનનો તકાળો છે. આપણી સિમિત અને દુનિયાના મસઅલાઓમાં ઘેરાએલી અકલ અબદ અને મઅબુદ, મોહુમ્મદ અને મેહમુદ દરમ્યાન થનારી ચર્ચાના ભેદને પામી નથી શકતી. બહુરહાલ હુદીસ ઉપર ગૌર કરીએ અને જોઈએ કે હજરત ઈમામે જમાના (અ.સ.)ની મોહુબ્બતને કયા અંદરુમાં રજુ કરવામાં આવી છે.

અય મોહુમ્મદ! પોતાની ઉમ્મતમાં કોને જાનશીન નિયુક્ત કર્યા છે? જ્યારે કે તેનું ઈલમ ખુદા પાસે હતું. અરજ કરી: પરવરદિગાર! મારા ભાઈને. ફરમાવ્યું: અય મોહુમ્મદ! અલી ઈબ્ને અબી તાલિબને? અરજ કરી: જુ હા, મારા પરવરદિગાર! ફરમાવ્યું: મેં જમીન ઉપર નજર કરી તો તમને ચુંટી કાઢ્યા. આથી જ્યાં જ્યાં મારો લિક થાય છે ત્યાં ત્યાં તમારો લિક થાય છે. હું મેહમુદ છું અને તમે મોહુમ્મદ છો. પછી મેં જમીન ઉપર બીજી વાર નજર કરી તો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ચુંટી કાઢ્યા. તેને તમારા વસી નિયુક્ત કર્યા. તમે અંબિયાના સરદાર છો અને તે અવસીયાના સરદાર છે. પછી મેં તેમનું નામ મારા નામથી રાખ્યું. હું ‘આઅલા’ છું અને તે ‘અલી’ છે.

અય મોહમ્મદ! મેં અલી, ફાતેમા, હુસન, હુસૈન અને ઈમામોને એક નૂરથી પૈછા કર્યા. પછી તમારી વિલાયતને મલાઅએકા અને બીજા લોકોની સમક્ષ રજુ કરી. બસ પછી જેણે કબુલ કરી તે મોઅમ્મીન થયો અને જેણે વિલાયતનો ઈન્કાર કર્યો તે કાફીર થયો.

અય મોહમ્મદ! અગાર મારો કોઈ બંદો મારી એટલી ઈબાદત કરે કે ટુકડે ટુકડા થઈ જાય અને મારાથી એ હાલતમાં મુલાકાત કરે કે તે તમારી વિલાયતનો ઈન્કાર કરતો હોય તો હું તેને જહુન્નમમાં નાખી દઈશ. અય મોહમ્મદ! શું તમે તે લોકોને જોવા ચાહો છો? અરજ કરીઃ યકીનન હા, અય મારા પરવરદિગાર! ફરમાવ્યુઃ સામે ઉભા રહી જાવ. હું સામે ઉભો રહી ગયો ત્યારે મેં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), હુસન ઈબ્ને અલી (અ.સ.), હુસૈન ઈબ્ને અલી (અ.સ.), અલી ઈબ્ને હુસૈન (અ.સ.), મોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.), જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.), મુસા ઈબ્ને જઅફર (અ.સ.), અલી ઈબ્ને મુસા (અ.સ.), મોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.), અલી ઈબ્ને મોહમ્મદ (અ.સ.), હુસન ઈબ્ને અલી (અ.સ.) અને હુજજતુલ કાઅેમ (અ.સ.)ને જોયા. જે તેઓ બધા દરમ્યાન રોશન સિતારાની માફક ઉત્તા. અરજ કરીઃ મારા પરવરદિગાર! આ કોણ લોકો છે? ફરમાવ્યુઃ આ બધા ઈમામ છે અને *الْقَائِمُ مَكَّاً* આ કાઅેમ છે. તેઓ મારા હુલાલને હુલાલ અને મારા હુરામને હુરામ કરાર દેશે અને મારા દુશમનોથી ઈન્તેકામ લેશે.

يَا حَمْدُ أَحَبِّهِ فَإِنِّي أُحِبُّ مَنْ يُحِبُّهُ

‘અય મોહમ્મદ! આ (કાચેમ)થી મોહમ્મત કરો કારણ
કે હું તેમને ખુબ જ ચાહું છું અને તેને પણ ચાહું છું જે
તેમનાથી મોહમ્મત કરે છે.’

(ગયબતે નોઅમાની, પાના નં. ૫૮)

આ હંદીસના અંતિમ જુમલાઓ ઉપર ધ્યાન આપો. બધા નભીઓ અને મુરસલીનમાં ફક્ત પયગમ્બરે અકરમ (સ.અ.વ.) નભી અને રસુલ છે કે જેમનો લકબ હબીબુલ્લાહ (અલ્લાહના ચહીતા) છે. હબીબ એ સિફતે મુશાબેહ છે એટલે કે તે કે જેમને ખુબ જ તિવ્રતાથી ચાહવામાં આવ્યા હોય અથવા જેમની સાથે તિવ્ર મોહમ્મત કરવામાં આવી હોય અને તેમાં પણ ખુદા જેને હબીબ કરાર હે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અલ્લાહ તાલાની તિવ્ર મોહમ્મતના બાવજુદ જે મોહમ્મતના આધારે ખુદાએ પોતાના નામની સાથે પયગમ્બરનું નામ રાખ્યું છે, કલમામાં, અજાનમાં, એકામતમાં, નમાજમાં. દરેક જગ્યાએ પોતાના નામની સાથે સાથે પયગમ્બરનું નામ પણ રાખ્યું છે. તેના વગર કોઈનો પણ ઈસ્લામ અને ઈમાન કબુલ નથી કર્યું. આટલી તિવ્ર નજીદીકી અને મોહમ્મત હોવા છતાં ખુદા ફરમાવે છે:

‘અય મારા હબીબ! આ કાચેમ (અ.સ.)થી મોહમ્મત
કરો કારણ કે હું તેમને ખુબ જ ચાહું છું અને તેને પણ ચાહું
છું જે તેમનાથી મોહમ્મત કરે છે.’

અર્થात् અય પયગામ્બર (સ.અ.વ.)! તમે હુભીબ છો પરંતુ અગર તમે ચાહુતા હો કે અમારી મોહુબ્લત તમારાથી વધારે ગાઢ થાય અને તેમાં હજુ વધારો થાય તો તમે આ કાણેમ (અ.સ.)થી મોહુબ્લત કરો. આનાથી અંદાજ લગાવી શકાય છે કે જે લોકો હજરત વલીએ અસ્ર (અ.સ.)થી ખુબ જ મોહુબ્લત કરશે. તેઓને પોતાના ઉપર અને પોતાના ઘરવાળાઓ ઉપર, પોતાના ખાનદાન ઉપર, પોતાના માલ અને અવલાદ ઉપર અગ્રતા આપશે તેઓ એ લોકોમાં શામેલ થશે કે જેનો લિક ખુદાવંડે આલમે મેઅરાજની રાત્રે આસ્માની મેહફીલમાં પોતાના હુભીબની સામે કર્યો હતો. આ ઉપરાંત ઈમામે અસ્ર (અ.સ.) રોશાન સિતારાની માફક ચમકતા હોવા એ તેમના ખાસ મહુત્વને ઉજાગર કરે છે.

એક બીજી રિવાયત:

હજરત ઈમામ અલી ઈબ્ને મુસા અર રેગા (અ.સ.) એ પોતાના બાપ-દાદાઓથી અને તેમણે ઈમામ અલી (અ.સ.)થી અને તેમણે હજરત રસુલે ખુદા (સ.અ.વ.)થી આ રિવાયત નોંધી છે. હજરત રસુલે ખુદા (સ.અ.વ.) એ એક હુદીસમાં ઈમામોનો લિક કરતા ફરમાવ્યું:

‘જે ખુદાવંડે આલમથી એ હાલતમાં મુલાકાત કરવા ચાહતો હોય કે તેનું ઈમાન સંપૂર્ણ હોય, તેનો ઈસ્લામ શ્રેષ્ઠ હોય તો તેનો જોવે કે તે સાહેબુગ્રજમાન, હુશ્રજત અલ મુન્તજરની વિલાયતને કબુલ કરે. આ હજરત અંધકારના દિવાઓ છે, હિંદાયતના રેહનુમા છે, તકવા અને પરહેજગારીના મિનારા છે. જે તેમનાથી મોહુબ્લત કરશે, તેની વિલાયતને કબુલ કરશે તો ખુદાની બારગાહમાં હું તેની જન્મતની જમાનત લઉ છું.’

(બેહારુલ અન્વાર, ભાગ-૩૬, પાના નં. ૨૮૬, દ. ૧૨૫)

આ હિન્દુરત વલીએ અસ્ટર (અ.સ.)ની ખાસ અર્જમત અને ખુસુસીયત છે કે જેના આધારે હિન્દુરત ઈમામ જાહેર સાંદ્રિક (અ.સ.) ફરમાવે છે:

لَوْ أَدْرِكْتُهُ لَخَلَمْتُهُ أَيَّامَ حَيَاةٍ

‘અગર હું તેમનો ઝમાનો પામતે તો આખી લિંદગી
તેમની બિદમત કરતો.’

(બેહારુલ અન્વાર, ભાગ-૫૧, પા. ૧૪૮, પ્ર. ૬, દ. ૨૩, ઈથે જયનથ
અલ નોઅમાની ર.અ.ની અલ ગયબતમાંથી નકલ કરતા)

અઈમ્મએ માસુમીન (અ.મુ.સ.) હિન્દુરત વલીએ અસ્ટર (અ.સ.)થી કેટલી હુદે મોહિબત કરતા હતા અને કેટલી હુદે તેમના વિયોગમાં આંસુઓ વહુવતા હતા. તેનો એક બનાવ અહીં વર્ણવવાની ખુશાખ્ખી ગ્રાપ્ત કરી રહ્યા છીએ.

સુદૈર સેરકીનું બયાન છે કે હું મુક્કજીલ બિન ઉમર, અખુ બસીર અને અબાન બિન તગલબ અમારા આકા અને સરદાર હિન્દુરત ઈમામ જાહેર સાંદ્રિક (અ.સ.)ની બિદમતમાં હાજર હતા. અમે જોયું કે ઈમામ (અ.સ.) જમીન ઉપર બેઠા છે અને તેમની ઉપર એક ચાદર છે જેમાં ખીસુસુ નથી અને બાંધો ચડાવેલી છે અને એવી રીતે ગિર્યા કરી રહ્યા છે કે જેવી રીતે એક માં પોતાના જવાન પુત્રના ગમમાં રડી રહ્યી હોય. અત્યંત ગમળીન અને મુસીબતના આસાર આપના મુનવ્વર ચહેરા ઉપર વર્તાય રહ્યા હતા અને રૂખસારોનો રંગ પણ બદલાય ગયેલો હતો. આંખો આંસુઓથી ભરેલી હતી અને આમ ફરમાવી રહ્યા હતા:

سَيِّدِيْنِيْ غَيْبَتُكَ نَفَّثُ رُقَادِيْ وَ ضَيَّقَتُ عَلَى مِهَادِيْ
وَ ابْتَرَثَتْ مِنْ رَاحَةَ فُؤَادِيْ سَيِّدِيْنِيْ غَيْبَتُكَ أَوْصَلَتْ مُصَابِيْ
بِفَجَائِعِ الْأَبْدِ...

‘મારા આકા! આપની ગયબતે મારી ઉંઘને ઉડાડી દીધી છે. મારા આરામને ખત્મ કરી દીધો છે અને દિલના ચૈનને છિનવી લીધું છે.

મારા આકા! તમારી ગયબતે મારા ગમ અને મુસીબતને હું મેશાની કરી નાખી છે. મસાઓબને યાદ કરીને હવે તો એ એહસાસ પડું નથી થતો કે કયારે આંખોથી આંસુઓ નીકળે છે અને કયારે ચાસ લઉ છું...’

સુદેરનું બયાન છે કે આ મંજર જોઈને અમારા હોશ ઉડી ગયા, અકલ રૂખસત થઈ ગઈ, અમારા દિલ ઉપર એવો ગમ અને મુસીબત છવાઈ ગઈ કે તેનું શું બયાન કરું. અમને એ મહેસુસ થયું કે ઈમામ (અ.સ.) ઉપર કોઈ મોટી મુસીબત નાઝીલ થઈ ગઈ છે. ઈમામ (અ.સ.)ની પવિત્ર બારગાહુમાં અરજ કરીઃ અય બેહુતરીન મખલુકના ફરજંદ! તમે ન રડો. આ કયા ગમે આપના આંસુઓને જારી કરી દીધા છે અને આ ગિર્યા અને માતમનું કારણ શું છે.

ઈમામ (અ.સ.) એ એક લાંબી આહ નાખી અને ઈમામના ગમમાં વધારો થઈ ગયો અને ફરમાવ્યુઃ

‘અફસોસ થાય તમારી ઉપર! હું આજે સવારે કિતાબે જફર જોઈ રહ્યો હતો. જેમાં ખુદાની તકદીરો અને આજમાઈશોનું વર્ણન હતું. જે કંઈ અત્યાર સુધી થઈ ચુક્યું છે અને જે કંઈ કયામત સુધી થનારું

છે તે બધી બાબતોનો તેમાં લિક છે. આ કિતાબ ખુદાએ હિન્દુરત રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના પછી ખાસ તૌરથી ઈમામોને અતા ફરમાવી છે.

તેમાં મેં અમારા ગાએબની ગયબતનું વાર્ણન જોયું. લાંબી ગયબતને જોઈ અને તેમની લાંબી જુંદગીને જોઈ અને તે ઝમાનામાં મોઅમીનોની આજમાઈશોને જોઈ.

ગયબતના લાંબા હોવાના કારણે લોકોના દિલોમાં ઉદ્ભવનારી શંકાઓને જોઈ. દીનથી વધારે પડતા લોકોને મુરતદ થતા જોયા. લોકોને ઈસ્લામથી બહુર નીકળી જતા જોયા. ખુદાવંદે આલમ ફરમાવે છે કે “અમે દરેક ઈન્સાનના નામએ આમાલને તેની ગરદનમાં નાંખી દીધા છે.” તેનાથી મુરાદ વિલાયત છે. આ બધું જોઈને મારા ઉપર રૂદ્ધ તારી થઈ ગયું અને મને ગમ અને મુસીબતે ઘેરી લીધો...

(મુન્તખબુલ અસર, પાના નં. ૩૨૧-૩૨૨)

હજુ ઈમામે અસર (અ.સ.)ની ગયબત અસ્તિત્વમાં આવી ન હતી. ફક્ત કિતાબમાં તેનું વાર્ણન જોઈને હિન્દુરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) આટલી હુદે ગમગીન થઈ ગયા.

અગર આજે આપણા દિલોમાં આપણા ઝમાનાના ઈમામની જરા બરાબર પાણ મોહબ્બત હોત તો આપણે પાણ તેમના વિયોગમાં ગિર્યા અને ઝારી કરતા હોત. આ ગયબતના ઝમાનામાં જેવી રીતે મોઅમીનો અને એહુલેબેત (અ.મુ.સ.)ના ચાહુનારાઓ આજમાઈશોનો શિકાર બને છે અને દરેક પ્રકારની મુસીબતો અને બલાઓમાં ઘેરાય જાય છે. કેવી રીતે લાવારીસીની અને દરબદરની

ઝિંદગી પસાર કરી રહ્યા છે અને કેવી બેદદી અને બેરહમીથી કત્લ કરવામાં આવી રહ્યા છે...

આપણા પણ આંસુઓ વરસતા હોત, આપણી આંખો પણ ભીની હોત, આપણી રાતોની ઉંઘ પણ હુરામ થઈ જાત. અગર વર્તમાન પરિસ્થિતિની આપણી ઉપર કોઈ અસર નથી તો તેનું કારણ એ છે કે આપણે આપણા દિલોમાં જમાનાના ઈમામની મોહુબુતને મેહંસુસ નથી કરી રહ્યા.

કદાચ દુનિયાની મોહુબુતે અને વધારે પડતા ગુનાહોએ આ રીતે આપણા દિલ અને દિમાગ ઉપર કબજો જમાવી દીધો છે કે આપણામાં જમાનાના ઈમામની મોહુબુતનો એહસાસ બાકી નથી રહ્યો. જ્યારે કે આજ મોહુબુત દુનિયા અને આખેરતની ખુશાખ્તીની જમાનત છે.

ઇમામ (અ.સ.)ની ખિદમત

માતા પિતા પોતાના બાળકોને ભણાવે છે, તેઓને પરવાન ચઢાવે છે અને તેઓની દિલી તમન્ના એ હોય છે કે તેઓની અવલાદ મોટી થઈને કોઈ કામ પર લાગી જાય અથવા તો તેને કોઈ સારી નોકરી મળી જાય અને જ્યારે કોઈ મોટી કંપનીમાં અથવા તો ખાસ આંતરરાષ્ટ્રીય કંપનીમાં અથવા કોઈ મોટી સંસ્થામાં કોઈ નોકરી અથવા તો જવાબદારી મળી જાય છે તો તેને લિંડગીની કામ્યાબી અને ખુશબ્ધતૌ સમજવામાં આવે છે. તે આધારે વિઝિટિંગ કાર્ડ બનાવવામાં આવે છે અને ખુબ જ ફખ્રની સાથે બીજાની સમક્ષ રજુ કરવામાં આવે છે. ઈન્સાન બીજાઓની ગુલામીને આજના આ આધુનિક જમાનામાં ‘નોકરી’ અથવા તો ‘સેવા’ જેવા માનનીય નામથી યાદ કરે છે. તેના ઉપર ફખ્ર અને ગર્વ કરે છે. પરંતુ મુલ્કનો માલિક કે જેના કબજ્જાએ કુદરતમાં બધુ જ છે અને તે વલીએ મુત્લક કે જે અદ્દાહની પરવાનગીથી આ કાએનાત ઉપર સંપૂર્ણ અધિકારનો હક્ક ધરાવે છે, તેમની ગુલામી અને તેમની નોકરી અને તેમની ખિદમતને કોઈ ખાસ મહત્વ નથી આપતો અને તેથી જ જલીલ અને રૂસ્વા થાય છે. એટલા માટે કે ઈજાત તો ફક્ત અદ્દાહ સુખદાનહુ વ તચાલા માટે, તેના રસુલ માટે અને મોઅમ્બીનો માટે છે. જ્યારે તે ઈજાતદાર હજરતથી જોડાએલો નહિ હોય તો પછી કેવી રીતે તે ઈજાતદાર બની શકે? લોકો સમુદ્રને છોડીને અમુક સામાન્ય ટીપાઓથી જોડાવવા ઉપર ગર્વ મેહસુસ કરે છે. જ્યારે કે એ સામાન્ય ટીપાઓની કોઈ હૈસિથ્યત નથી કે બીજાઓને કંઈ આપી શકે.

બહુરહાલ અગર અત્યારના ઝમાનામાં કોઈ છે કે જે ફક્ત જમીનના અમુક હિસ્સાઓ પર નહિ બલ્કે સમગ્ર કાયેનાત ઉપર ખુદાની પરવાનગીથી માલિકીનો હક્ક ધરાવે છે અને જેના ઈઘ્યેયારમાં બધુ જ છે, તે ફક્ત હજરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી, આખેરુઝુમાન હજરત ઈમામ મહિદી (અ.સ.) છે, જે ઝમાનાના ઈમામ છે. તેઓ ફક્ત જમીન ઉપર નહિ બલ્કે સમગ્ર મખ્લુકાત ઉપર ખુદાની હુજ્જત અને તેના નુમાઈન્ડા છે. આ ગયબતના ઝમાનામાં તેમની બિદમત કરવાનો જે અજ અને સવાબ છે અને તેમના બિદમત ગુજરાતોની જે અજમત અને ભરતબો છે તે બયાન ન કરી શકાય તેવો છે, બલ્કે તે ઈન્સાનની સોચ અને વિચારથી પણ ખુબ જ બલંદ છે. આ અજમતનો અંદાજો ફક્ત તેનાથી લગાવી શકાય છે કે મઅસુમ ઈમામ કે જેમનો દરેક શાસ અલ્લાહુની ઈબાદત છે તેમનું ફરમાન છે:

‘અગર હું તેમનો ઝમાનો પામતે તો આખી જિંદગી
તેમની બિદમત કરતે.’

અર્થાત્ હજરત ઈમામ મહિદી (અ.સ.)ની બિદમત ખુદ એક અલ્લાહુ તઆલાની બલંદ ઈબાદત છે. અગર આપણે દુનિયામાં ઈજુઝત અને આખેરતમાં સાચાદતના બલંદતરીન દરજા પ્રાપ્ત કરવા ચાહુતા હોઈએ તો આપણે ઝમાનાના ઈમામની બિદમત કરવી જોઈએ.

આ સમયે ઈમામે અસ્ર (અ.સ.) ગયબતના પદ્ધામાં છે. નથી ખબર કે અત્યારે જમીનનો એ કયો ખુશ કિસ્મત હિસ્સો છે કે જ્યાં ઈમામે ઝમાના જિંદગી પસાર કરી રહ્યા છે? આથી આ પરિસ્થિતિમાં તેમની બિદમતમાં હાજર રહેવું અને આપણા શરીર

થકી તેમની બિદમત કરવાની શક્યતા દરેકને પ્રાપ્ત નથી. પરંતુ ખુદાવંદે આલમના ફરજ અને કરમથી એ પણ દૂર છે કે આ ગયબતના જમાનામાં રહેનારાઓને ઈમામે અસ્ર (અ.સ.)ની બિદમતની સઆદતથી સંપૂર્ણ રીતે વંચિત રાખે. એક રિવાયતમાં આ રીતે છે:

‘જે લોકો અમારી જિયારત માટે નથી આવી શકતા,
અગર તેઓ અમારા ઝાઓરની જિયારત કરે તો તેઓને
અમારી જિયારત કરવાનો સવાબ મળશે.’

અગર આપણે પ્રત્યક્ષ રીતે ઈમામે જમાનાની બિદમતની સઆદત પ્રાપ્ત નથી કરી શકતા તો બિજા રસ્તાઓ ખુલ્લા છે.

ખુદાવંદે આલમે સુરએ મુખારકે જુમ્મા અને બીજા સુરાઓમાં પયગમબરે અકરમ (સ.અ.વ.)ની જવાબદારીઓ આ રીતે બયાન ફરમાવી છે:

- ૧) અહ્લાહની આયતોની તિલાવત
- ૨) લોકોને ચારિત્ય અને રૂહાની રીતે પાકો પાડીજા કરવા એટલે કે તેઓની જિંદગીમાં હયવાની પહેલુઓ ઉપર ઈન્સાની પહેલુઓને અગતા આપવી
- ૩) ઈદમ અને હિકમતની તઅલીમ આપવી
- ૪) દીનની તબલીગ અને એહ્લેબૈત (અ.મુ.સ.)ની વિલાયત બીજાઓ સુધી પહોંચાડવી
- ૫) કુરાનની તઅલીમાતની સ્પષ્ટતા કરવી.

જો કે ઈમામ (અ.સ.) રસૂલે ખુદા (સ.અ.વ.)ના વસી, ખલીફા અને જાનશીન છે. આ આધારે ઈમામ (અ.સ.)ની જવાબદારીઓ પણ એજ પ્રકારની છે. એ બાબત સ્પષ્ટ છે કે આ બધા કાર્યો ફક્ત જુહુરના સમયથી મખ્સુસ નથી એટલે કે એમ નથી કે અત્યારે આપણી કોઈ જવાબદારી નથી, નહિ હરળીજ તેમ નથી. એ તમામ જવાબદારીઓ આજે પણ અદા કરવાની છે. શું લોકો નથી ચાહતા કે અલ્લાહ તથાતાના હુકમો અમલી બને? જે શાખસ આ ગયબતના ઝમાનામાં તે કાર્યોને અમલી સ્વરૂપ આપવાની કોશિશ કરશે તે ઝમાનાના ઈમામનો સૌથી શ્રેષ્ઠ બિદમત ગુજરાત હશે.

૧) અલ્લાહની આયતોની તિલાવત:

અલ્લાહની આયતોની તિલાવત કરવા માટે કુરઆને કરીમને જાગવું અત્યંત જરૂરી છે. ઓછામાં ઓછું આપણને દરેકને કુરઆને કરીમની એકદમ સાચી રીતે તિલાવત કરતા આવડવું જોઈએ. આ વાત કેટલી હુદે અફસોસનાક છે કે હજરત રસૂલે ખુદા (સ.અ.વ.) એ કુરઆને કરીમ અને એહલેબૈત (અ.મુ.સ.)ને એક સાથે કરાર દીધા છે અને એવી રીતે ફરમાવ્યું છે કે તે બન્નેમાં જુદાઈ કયારેય શક્ય નથી. તો પછી તે કેવી રીતે બની શકે કે આપણે એહલેબૈત (અ.મુ.સ.)ની મોહલ્લબતના દાવેદાર તો હોઈએ પરંતુ કુરઆને કરીમથી માહિતગાર ન હોઈએ. તેને યોગ્ય અને સારી રીતે પઢી ન શકતા હોઈએ. કુરઆને કરીમની સાચી અને યોગ્ય રીતે તિલાવત કરવી એ કુરઆનની તરફનો પહેલો તબક્કો છે. બીજો તબક્કો તેને તજવીદની સાથે પઢવું છે એટલે કે કુરઆનના શબ્દોને સહીહ અરભીમાં અદા કરવામાં આવે. ત્યારબાદ તરતીલ છે. આ બધા તો

કુરઆને કરીમની તિલાવત કરવાના તબક્કાઓ છે. કુરઆને કરીમને સમજવું એ એક બીજું મહત્વનું કાર્ય છે. કુરઆને કરીમ અલ્લાહ તાલાના કલામ છે. જે શાખસ ખુદાવંદે આલમની વાતોને સમજવા ચાહુતો હોય અને એ જાણવા ચાહુતો હોય કે ખુદા પોતાના બંદાઓથી શું ચાહે છે તો તેની એ જવાબદારી છે કે કુરઆને કરીમને સમજુને પઢે, તિલાવતની સાથે સાથે તેના અર્થ અને ભાવાર્થ ઉપર પણ ચિંતન મનન કરે. કારણ કે એહુલેબૈત (અ.મુ.સ.) આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે આથી તેમની મોહુબ્બતનો દમ ભરનારાઓને કુરઆને કરીમની તિલાવત અને તેને સમજવામાં સૌથી આગળ રહેવું જોઈએ. આ તે મૈદાન છે કે જેમાં આપણા બાળકો, બાળકીઓ અને નવયુવાનો વધારે પડતા આગળ નથી. દરેક ઘરમાં ફક્ત કુરઆને કરીમનું હોવુ એ કાફી નથી, બલ્કે તેની તિલાવત થવી પણ ખુબ જ જરૂરી છે. રિવાયતમાં છે કે ‘જે ઘરમાં કુરઆને કરીમની તિલાવત કરવામાં આવે છે, તે ઘર આસ્માનવાળાઓ માટે એવી રીતે ચમકે છે જેવી રીતે જમીનવાળાઓ માટે સિતારાઓ ચમકે છે.’ આ જમાનામાં શરીકે કુરઆન ઈમામે જમાના (અ.સ.)ની બિદમતનો એક રસ્તો કુરઆને કરીમની તિલાવત છે.

‘જે શાખસ એમ ચાહુતો હોય કે જન્નતમાં તેમની સાથે રહે તો તેને જોવે કે તે દરરોજ કુરઆને કરીમની તિલાવત કરે અને તેનો સવાબ ઈમામે જમાના (અ.સ.)ને હંદીયો કરે.’

(કાફી, ભાગ-૨, પાના નં. ૬૧૮, દ. ૪)

૨) ઇંદ્રાણી અને ચારિત્રયની તથાલીમ:

ઇંસાનને હુયવાની ખસલતોથી પાક કરીને ઇંસાનના અખલાક અને ચારિત્રયને તૈયાર કરવું એ સર્વશ્રેષ્ઠ કામ છે અને આ કામ અંબીયા (અ.મુ.સ.)નું કામ છે. આ જમાનામાં લોકોમાં અખલાકી તથાલીમને ફેલાવવી અને સૌથી શ્રેષ્ઠ અખલાકથી સુસજજ કરવા ઈમામે અસ્ર (અ.સ.)ની ખુશનુદ્દીનું સબબ છે.

જ્યારે હિન્દુરત વલીએ અસ્ર (અ.સ.)નો પૂરનૂર ઝુહુર થશે ત્યારે સમગ્ર દુનિયામાં ગાદીરી ઈસ્લામ પ્રચલિત કરશે. જો કે આ બધા કાર્યો સામાન્ય પદ્ધતિ થકી થશે. આ મહાન કાર્ય માટે ઘણા બધા લોકોની જરૂરત પડશે. એવા લોકોની જરૂરત પડશે કે જેમનું ઈમાન મજબુત હોય અને અમલ અને અખલાકમાં સરબલંદ હોય. આ પ્રકારના લોકોની તરબીયત કરવી ઈમામે અસ્ર (અ.સ.)ની મોટી ખિદમત છે. અખલાકના ઘરેણાઓથી સુશોભિત થવું ગયબતના જમાનાની એક મહત્ત્વની જવાબદારી છે. આ પ્રકારની તરબીયત મુશ્કીલ જરૂર છે પરંતુ અશક્ય નથી. જો કે મુશ્કીલ છે, તેથી તેનો અજ અને સવાબ પણ ખુબ જ છે. આ મુશ્કેલી તે સમયે આસાન થઈ જાય છે, જ્યારે આપણે હિન્દુરત વલીએ અસ્ર (અ.સ.)ને આપણા તમામ આઅમાલ ઉપર ગવાહ સમજુએ. તેમાં કોઈ શંકા નથી કે ઈમામ (અ.સ.) અલ્લાહ સુખુનાહ વ તઆલાની સિફાતોનો અરીસો છે. ખુદાવંદે આલમ તે છે કે જે દરેક વસ્તુનું ઈદમ ધરાવે છે. તે દરેક વસ્તુને જોઈ રહ્યો છે અને દરેક વાત સાંભળી રહ્યો છે. તે દરેક બાબત ઉપર ગવાહ છે. આથી હવે જે શાખસ ઈમામ (અ.સ.)ને મઅસુમ સમજતો હોય, તેમને અલ્લાહના નુમાઈન્દા અને ખલીફા સમજતો હોય તેણે એ યકીન

રાખવું જોઈએ કે અલલાહુના નુમાઈન્દા ઈમામે ઝમાના (અ.સ.) આપણા તમામ આઅમાલથી માહિતગાર છે અને દરેક વાત ઉપર ગવાહ છે.

ચોક્કસ તે શાખ્સ જે પોતાના તમામ આઅમાલ બલ્કે પોતાની વિચારધારા અને ખયાલ ઉપર પણ પોતાના ઈમામને ગવાહ જાણતો હોય અને જેનો એ અકીદો હોય કે આપણા દરેક અમલથી આપણા ઈમામ માહિતગાર છે તો તે ઈન્સાન જરૂર પોતાના આઅમાલ અને અખલાકની સુધારણા કરશે. એટલા માટે કે આ ગુણોની સાથે ઈમામની સમક્ષ જવામાં તે શરમ અનુભવશે કે જે ઈમામને નાપસંદ છે.

અત્યારે આપણા સમાજમાં જે સમસ્યાઓ દેખાય રહી છે, સંબંધો ટૂટી રહ્યા છે, ઘરો બરબાદ થઈ રહ્યા છે, વિરોધાભાસ વધી રહ્યો છે, તરકીને બદલે પડતી થઈ રહી છે તેનું કારણ એ નથી કે અગાઉની સરખામણીએ સગવડતાઓ ઓછી થઈ ગઈ છે અથવા ભાગેલા ગાણેલા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે... બલ્કે તેનું કારણ એ છે કે આપણી ચારિત્યની હાલત ખરાબથી ખરાબ થઈ ગઈ છે અને વધુને વધુ ખરાબ થઈ રહી છે. આપણે થોડીવાર માટે વિચાર કરીએ કે આ સંબંધોનું ટૂટવું, આ ઘરોનું બરબાદ થવું, આ બાળકોનું માં-બાપની મોહબ્બતથી વંચિત થવું, આ વિરોધાભાસનું વધવું, શું આ બધુ આપણા ઈમામ (અ.સ.)ને પસંદ છે? શું આ બધી પરિસ્થિતિનું ઈદમ આપણા ઈમામને નથી? શું આ બધી વાતો ઈમામ (અ.સ.)ની નારાઝગીનું કારણ નથી? ચોક્કસ છે.

તો દરેક તે શાખ્સ કે જે ચારિત્યની સુધારણાની કોશિશ કરશે અને સમાજમાં અખલાકી કદ્રોને જીવંત કરશે તે ઈમામ (અ.સ.)ની

દોઆઓમાં શામેલ થશે. આ રૂહાની અને ચારિત્રયની તઅલીમ ઈમામ (અ.સ.)ની એક બિદમત છે. આજે આપણા સમાજમાંથી અખલાક એટલા માટે રૂપ્સત થઈ ગયો છે કે આપણે તેનું વર્ગન કરવાનું છોડી દીધું છે.

તે લોકો કે જેઓ હુઝરત વલીએ અસર (અ.સ.)નો ઈન્ટેજાર કરી રહ્યા છે, એહુલેબૈત (અ.મુ.સ.)ના અખલાકથી સુસજજ થવાને પોતાની જવાબદારી સમજી રહ્યા છે અને તેઓની જબાન ઉપર ઈમામ (અ.સ.)ના ઝુહુરના વહેલા થવાની દોઆ છે તો તેઓનું દિલ પણ તેમના આગમન માટે તૈયાર હોવું જોઈએ. કારણ કે બારગાહે ઈમામતમાં ખુલુસે દિલ અને પાક દિલનું ખુબ જ મહત્વ છે, રિયાકારીનું નહિ. દિલમાં દરેક માટે સારુ ઈચ્છવામાં આવતું હોય, મખ્લુકે ખુદાથી નફરત કરવી દિલના વાતાવરણને ખરાબ અને બદબુદ્ધ બનાવી દે છે. સાહેબાને તત્ત્વીરથી મોહબ્બત કરવા માટે દિલનું પાકો પાકીજા હોવું ખુબ જ જરૂરી છે.

ઈમામ (અ.સ.)નો ઈન્ટેજાર કરનારે ફક્ત ખુદા ઉપર ભરોસો કરવો જોઈએ. તેણે પોતાના દિલ અને દિમાગને ફક્ત ખુદાને સોંપી દેવા જોઈએ. દિલ ફક્ત ખુદા અને ખુદાવાળાઓની મોહબ્બતથી એટલી હુદે ભરપૂર હોવું જોઈએ કે તેમાં બીજા કોઈ માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. દિલની પાકીજા જમીન શેહુવત, ગફ્ફલત અને ગુસ્સાની જગ્યા નથી. આ બધી તો શયતાનની ચરાગાહ છે. જે શાખ પોતાની જાતને શયતાનને સોંપી દેશો તે રેહમાનનો બંદો કેવી રીતે બની શકે છે?

ઈમામ (અ.સ.)નો ઈન્ટેજાર કરનારે પોતાના દિલની હાલતને આ દુનિયા અને તેની રંગીનીઓની મોહબ્બતથી પાક રાખવી

જોઈએ. સાચી દોસ્તીનો તકણો એ છે કે દોસ્તના દુશ્મનથી દુશ્મની રાખવી છે. એ વાત બિલ્કુલ સ્પષ્ટ છે કે એહુલેબૈત (અ.મુ.સ.) એ કયારેય પણ દુનિયાને પસંદ કરી નથી. તો પછી તેઓ તે લોકોને કેવી રીતે પસંદ કરશે અને તેને પોતાના લશકરમાં કેવી રીતે શામેલ કરશે કે જેઓ દુનિયાના ગુલામ થઈ ગયા હોય.

એહુલેબૈત (અ.મુ.સ.) ખુદાની નજીદીકીની એ બલંદ મંજીલ ઉપર ફાએઝ છે કે જ્યાં કોઈ પણ મલકે મુકર્રબ અથવા તો નબીએ મુરસલ પહોંચી શકતું નથી. આ બલંદ મંજીલ સુધી પહોંચવું તે કોઈના હાથની વાત નથી. પરંતુ તે રસ્તા ઉપર જરૂર ચાલી શકાય છે અને તે દિશામાં જરૂર કદમ ઉઠાવી શકાય છે. અગર ઈન્સાન પોતાને એહુલેબૈત (અ.મુ.સ.)ના અખલાકથી સુસજજ કરી લે તો મૌના આહેل બીબીત એટલે કે એહુલેબૈત (અ.મુ.સ.)માંથી ની મંજીલ ઉપર જરૂર પહોંચી શકે છે પછી ભલે તેનો વંશ એહુલેબૈત (અ.મુ.સ.)થી ન મળતો હોય અને તેનાથી ઉદ્ઘૂર અગર તે રસ્તાનો મુસાફીર નહિ હોય તો આ હી લહેટ યિદા એટલે કે અખુ લહુબના બંને હાથો ભાંગી જાયનું ઉદાહરણ બનશે, ભલે પછી તે સગાવહાલામાંથી કેમ ન હોય.

બહુરહાલ આ ગયબતનો જમાનો કે જે ઈમામ (અ.સ.)ના જુહુર માટે આમાદા અને તૈયાર થવાનો જમાનો છે. તેમાં પોતાની જાતને એહુલેબૈત (અ.મુ.સ.)ના અખલાકથી સુસજજ કરવી અને બીજાઓમાં એહુલેબૈત (અ.મુ.સ.)ના અખલાકની તઅલીમને ફેલાવવી તે ઈમામે જમાના (અ.સ.)ની એક ખિદમત છે. આ તે ઘરાનો છે કે જે ખાડીમોની ખુબ જ દેખભાળ કરે છે.

૩) ઈલ્ય અને હિકભતની તખલીમ:

પયગમબરે અકરમ (સ.અ.વ.) એ અમૃક છોકરાઓને જોઈને ફરમાવ્યું:

‘આખરી જમાનાના બાળકો ઉપર તેમના વાલેદૈનના કારણે અફસોસ.’

લોકોએ પુછ્યું: શું મુશ્રીક વાલેદૈન તરફથી? ફરમાવ્યું: નહિ. બલ્કે તે વાલેદૈન સંબંધીત કે જે મોઅમીન છે. આ લોકો પોતાના બાળકને દીનની તખલીમ નહિ આપે. ન ફક્ત દીનની તખલીમ નહિ આપે બલ્કે તેઓને દીનની તખલીમ પ્રાપ્ત કરવાથી મનાઈ કરશે. આ લોકો દુનિયાના બાહુ ઓછા ફાયદા ઉપર ખુશ થઈ જશે. હું તેવા લોકોથી બેઝાર છું અને તે લોકો મારાથી દૂર છે.

(જામેઉલ અધ્યાર, પાના નં. ૧૦૬)

પયગમબરે અકરમ (સ.અ.વ.) કંઈ સામાન્ય વાત ઉપર અફસોસ પ્રદર્શિત કરતા ન હતા. અફસોસનું પ્રદર્શિત કરવું એ દર્શાવી છે કે વાત અત્યંત મહત્વની છે કે જેનું દર્દ આં હુઝરત (સ.અ.વ.) અનુભવી રહ્યા છે. પયગમબરે અકરમ (સ.અ.વ.)ને દુઃખી કરવા કોઈ પણ મોઅમીન માટે શોભીતું નથી અને ન તો ઈમાન તેની રજા આપે છે.

આ ઉપરાંત આં હુઝરત (સ.અ.વ.)નું તે લોકોથી બેઝાર હોવાનું એલાન કરવું દર્શાવી રહ્યું છે કે આ પ્રકારના લોકોની આખેરત કેટલી હુદે દર્દનાક હશે.

આ તો તે લોકોનો અંજામ છે કે જેઓ પોતાની અવલાદને દીનની તઅલીમ નથી આપી રહ્યા હું વે જરા એ લોકોની મંજેલત અને દરજજાને પણ જોઈએ કે જેઓ ઈલમ અને હિકમતની તઅલીમાતથી બીજાઓને ટૃપ્ત કરાવી રહ્યા છે.

ઉઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ પોતાના દાદા ઉઝરત ઈમામ મોહમ્મદ તકી (અ.સ.)થી આ રિવાયત નોંધ કરી છે કે:

‘તે આલીમ જે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના તે યતીમોની સરપરસ્તી કરે કે જેઓ પોતાના જમાનાના ઈમામથી દૂર છે, હૈરાન અને પરેશાન છે, શયતાનની આળમાં સપડાયેલા છે, અમારા દુષ્મનોના ઘેરામાં છે. જે તેઓને આ હૈરાની અને પરેશાનીમાંથી બહાર કાઢશે, શયતાની વસવસાઓને દૂર કરશે, અઈમયે મઅસુમીન (અ.મુ.સ.)થી પ્રાપ્ત કરેલા દલીલ અને બુરહાન થકી દુષ્મનો ઉપર પ્રભુત્વ હાસીલ કરશે તે આલીમોની ફરીલત અને મહાનતા ઈબાદતગુર્જારો ઉપર એવી રીતે છે જેવી રીતે આસ્માન, અર્શ, કુરસી અને હિજાબાતની મહાનતા જમીન ઉપર અથવા તો સામાન્ય સિતારાઓ ઉપર ચઉદમીના ચાંદની માફક.’

(તક્સીરે ઈમામ હસન અસ્કરી (અ.સ.), પાના નં. ૩૪૪, દ. ૨૨૪)

આ સિલસિલામાં અમીરુલ મોઅમેનીન ઉઝરત અલી ઈલ્લે અખી તાલિબ (અ.સ.)થી એક રિવાયત છે:

‘અમારો તે શીખા જે અમારી શરીરાતથી માહિતગાર છે અને તેનું ઈલમ ધરાવે છે, અમારા કમજોર શીખાઓને જેહાલતના અંધકારથી આ ઈલમના નૂરની તરફ લાવે કે જે અમે તેઓને અતા કર્યું છે તો તે શખ્સ કયામતના મૈદાનમાં એવી રીતે લાવવામાં આવશે કે તેના માથા ઉપર નૂરનો એક તાજ હશે કે જેનું પૂર તમામ મહેશરવાસીઓને પ્રકાશિત કરી રહ્યું હશે અને તેના શરીર ઉપર એવો કિંમતી લિબાસ હશે કે તેનો એક દોરો સમગ્ર ફુનિયાથી વધારે કિંમતી હશે.

તે સમયે એક શખ્સ અવાજ આપશે અય ખુદાના બંદાઓ! આ આલે મોહમ્મદના અમૃક આલીમોનો એક શાળીદ છે. તેણે જેને પણ ફુનિયામાં જેહાલતની પરેશાનીઓમાંથી કાઢ્યા છે તેઓ તે નૂરથી ઓડાય આય કે જેથી મહેશરના અંધકારથી જન્મતની નૂરાનિયત સુધી પહોંચાડી દે.

આથી દરેક તે શખ્સ કે જેને તેણે ફુનિયામાં એક નેકી તઅલીમ કરી હશે અથવા તો તેના દિલથી જેહાલતના કોઈ તાળાને ખોટ્યું હશે અથવા કોઈ શંકા બાબતે સ્પષ્ટતા કરી હશે અને તે શંકામાંથી દૂષ્ટકારો અપાવ્યો હશે તે બધાને તે જન્મતમાં લઈ જશે.’

(તક્ષસીરે ઈલમામ હસન અસ્કરી (અ.સ.), પાના નં. ૩૩૮)

ખુદાના બંદાઓને દીનની તઅલીમાતથી પરિચિત કરાવવા, તેઓને હુલાલ અને હુરામથી માહિતગાર કરાવવા તે રસૂલે ખુદા (સ.અ.વ.) અને તેમના વલીઓનું કામ છે. આ ગયબતના

જમાનામાં જે તે રસ્તા ઉપર કદમ ઉઠાવશે તેને જમાનાના ઈમામની બિદમત ગુજરાતીનો શરદી પ્રાપ્ત થશે. જેટલી હુદે ઈલમ અને હિકમતની તઅલીમાતને ફેલાવવામાં તેનો ફાળો હશે તેટલોજ તેનો દરજજો વધારે બલંદ હશે.

૪) એહલેબેત (અ.મુ.સ.)ની વિલાયતની તખ્લીગઃ

ઉઝરત રસુલે ખુદા (સ.અ.વ.) તમામ અંબિયા અને મુરસલીનાના સરદાર અને અલલાહુની બારગાહુથી દરેક નજીક લોકોના સૈયદ અને સરદાર છે. તેમની રિસાલત અને નુભુર્વતથી વધારે કોઈની રિસાલત અને નુભુર્વત નથી. તેમના પયગામથી શ્રેષ્ઠ કોઈનો પયગામ નથી. તેમની જવાબદારીઓથી વધારે કોઈની જવાબદારી નથી. તેમની તખ્લીગથી ઉચ્ચ કોઈની તખ્લીગ નથી અને તેમની જિંદગીથી શ્રેષ્ઠ કોઈની જિંદગી નથી.

આગર આપણે આં હુઝરત (સ.અ.વ.)ની સિરત ઉપર એક નજર કરીએ તો આપણાને જાણાશે કે આં હુઝરત (સ.અ.વ.) એ પોતાની સામાન્ય તખ્લીગ અને દઅવતની શરૂઆત મક્કાએ મોકરેમાં ‘દઅવતે જુદ્ધઅશીરા’ થી કરી હતી અને છેલ્લી તખ્લીગ ગદીરે ખુમમાં ફરમાવી હતી. દઅવતે જુદ્ધઅશીરા પણ અલલાહુના હુકમ ઉપર અમલ હતો કુન્ડુરીની અંતર્ગત અનુસરણ હતું ... “અને તમારા નજીકના સગાવહુલાઓને ડરાવો.” નું પાલન હતું અને ગદીરમાં એલાન આયાએ બલલીગનું અનુસરણ હતું. પ્રથમ દઅવત પણ ખુદાના હુકમથી અને આખરી એલાન પણ ખુદાના હુકમથી હતું. બન્ને જગ્યાઓએ હુઝરત મુરસલે આઅઝમ (સ.અ.વ.) એ ઈમામ અલી ઈજને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત, બિલાક્ષત,

વિસાયત અને ઈમામતનું એલાન ફરમાવ્યું. એટલે કે રિસાલતની શરૂઆત અને તેનો અંત એહુલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત છે. આજ તે મહુત્ત્વનો વિષય છે કે જે શરૂઆતથી જ હુમલાઓનો શિકાર રહ્યો છે અને આજે પણ તેના ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. આથી તેનો બચાવ કાલે જેટલો જરૂરી હતો તેટલોજ આજે પણ જરૂરી છે. કારણ કે હુમલાઓ કરવાનો અંદાજ અને પદ્ધતિ બદલાય ગઈ છે. આ આધારે બચાવ અને રક્ષણાની પદ્ધતિ પણ અલગ હશે.

ઉત્તરત ઈમામ જાફરે સાદિક (અ.સ.) એ ખર્સમાને ફરમાવ્યું:

‘અમારા ચાહનારાઓને અમારા સલામ કહેજો અને તેઓને આ પયગામ આપજો કે તેઓ ખુદાનો તકવા ઈઘ્તેયાર કરે, નેક આમાલ બજાવી લાવે, તંકુરસ્ત લોકો બિમારોની અયાદત કરે, માલદાર લોકો ગરીબોનો ખચાલ કરે. જીવંત લોકો મરનારના જનાઝામાં શરીક થાય, એકબીજાઓના ઘરે જાય અને દીનના ઈલમની ચર્ચા કરે.

તેમાં અમારા અમૃતની લિંદળી છે.

ખુદાયા! તેને ઉપર રહેમ કરે જે અમારા અમૃતને જીવંત કરે.’

(બેહદુલ અન્વાર (બેરૂત), ભાગ-૭૮, પાના નં. ૨૧૮)

એક બીજી હંદીસમાં આ પ્રમાણે ફરમાવ્યું:

‘એકબીજાના ઘરે જાવ, તેઓની એકબીજાથી મુલાકાત અમારા અમૃતની લિંદળી છે.’

ત્યારબાદ ઈમામ (અ.સ.) એ હાથોને બલંદ કરીને આ દોઆ
ફરમાવી:

رَحْمَ اللَّهُ مَنْ أَحْيَا أَمْرَنَا

‘ખુદાયા! તેના ઉપર રહેમ કર જે અમારા અમ્રને જીવંત
કરે.’

(બેહારુલ અન્વાર, ભાગ-૭૧, પાના નં. ૨૨૩)

એક બીજુ હંડીસમાં આમ ફરમાવ્યું:

أَحْيِوْا أَمْرَنَا رَحْمَ اللَّهُ مَنْ أَحْيَا أَمْرَنَا

‘અમારા અમ્રને જીવંત કરો, ખુદા તેના ઉપર રહેમ કરે
જે અમારા અમ્રને જીવંત કરે.’

(હંડીયતુલ ઉમ્માહ એલા એહુકામીલ અઈમ્માહ, ભાગ-૫, પાના ૧૮૩)

إِجْتَمِعُوا وَ تَذَكَّرُوا تَحْفَ بِكُمُ الْمَلَائِكَةُ رَحْمَ اللَّهُ مَنْ أَحْيَا أَمْرَنَا

‘એક જગ્યાએ એકઠા થઈ અમારી હંડીસોનો ટિક કરો,
મલાઓકા તમને ધેરી લેશો. ખુદા તેના ઉપર રહેમ કરે જે
અમારા અમ્રને જીવંત કરે.’

(વસાએલુશશીઆ, ભાગ-૧૨, પાના નં. ૨૨)

હજરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)નું હાથોને બલંદ કરીને
દોઆ કરવી એ કંઈ સામાન્ય ફળીલતની વાત નથી. દુનિયાનું
મોટામાં મોટું ઈનામ આ દોઆની સામે કંઈ મહત્ત્વ નથી ધરાવતું.
અગર આ ગયબતના જમાનામાં ઈમામ સાદિક (અ.સ.)ની

દોઆઓમાં શામેલ થવા ચાહુતા હોઈએ તો તેમની ઈમામત અને વિવાયતના અપ્રને જીવંત રાખીએ.

ઉજરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની આ રિવાયત કેટલી અજીવ છે. ખુદાવંદે આલમ આપણને તે રિવાયતના અર્થ અને ભાવાર્થને સમજવાની અને તેના મિસ્ટાક (ઉદાહરણ) બનવાની તવફીક અતા ફરમાવે.

ઈમામ (અ.સ.) એ મયસરને પુછ્યું:

‘શું તમે લોકો કયારેય આપસમાં બેસો છો અને હદ્દીસોનો લિક કરીને ચર્ચા કરો છો?’

અરજ કરીઃ જી હા. અમે બેસીએ છીએ, હદ્દીસોનો લિક કરીએ છીએ અને ચર્ચા કરીએ છીએ.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

‘ખુદાની કસમ! હું પુણ અમૂક સમયે આ પ્રકારની બેઠકોમાં શામેલ થવા ઈરદું છું. ખુદાની કસમ! હું તમારા લોકોની ખુશબુને પસંદ કરું છું. તમારી જાનોથી મોદુલબત કરું છું. તમે લોકો ખુદાના દીન ઉપર છો, મલાયોડાના દીન ઉપર છો. હાં, પરહેઝગારી અને ઈજતેછાદમાં કોશિશ થકી મારી મદદ કરો.’

(કાફી, ભાગ-૨, પાના નં. ૧૮૭, હ. ૫)

આ પ્રકારની રિવાયતોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે અઈમામએ મઅસુમીન (અ.મુ.સ.)ને આ પ્રકારની મજલીસો અને બેઠકોમાં શામેલ થવું કેટલું પસંદ છે અને જ્યાં તેમનો અમૃ જીવંત કરવામાં આવતો હોય ત્યાં તેઓ શરીક થવા ચાહે છે. અગર આપણે એ

ચાહુતા હોઈએ કે આપણા જમાનાના ઈમામ હુજરત વલીએ અસ્ર (અ.સ.) આપણી મજલીસો અને બેઠકોમાં શરીક થાય તો આપણે તેમની હંડીસોનો લિક કરવો જોઈએ અને ઈમામત અને વિલાયતના અભ્રને જીવંત રાખવો જોઈએ.

ખુદાવંદ આલમને તેની અજમત અને જલાલત તથા અસ્માએ હુસ્નાનો વાસ્તો આપીને મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના સદકામાં હિલના ઉડાણથી, ખુલુસે નિયતની સાથે દોઆ કરીએ કે આ ગયબતના જમાનામાં ઈમામની બિદમતની એવી તવફીક અતા ફરમાવે કે જે ઈમામે જમાના (અ.સ.)ની ખુશનુદ્દી અને તેમના પવિત્ર હોઠો ઉપર મુસ્કુરાહટનું કારણ બને. આમીન.